

B.Com. Semester - 6 (CBCS) Examination
March/April-2026 (NEW COURSE)
Accounting-6 (Elective (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧ બુશી સ્ટોર્સ લિમિટેડ તેની જુદી જુદી શાખાઓને મૂળ કિંમતે માલ મોકલે છે અને શાખાઓ ઉધાર તેમજ રોકડેથી (૨૦) વેચાણ કરે છે જુનાગઢ શાખા ને લગતી નીચે આપેલી વિગતો પરથી મુખ્ય ઓફિસના ચોપડામાં શાખાનું વેપાર ખાતુ, નફા નુકસાન ખાતુ તથા શાખા ખાતું તૈયાર કરો.

દેવાદારો 1 એપ્રિલ 2023 રૂ.	2,620
દેવાદારો 31 માર્ચ 2024 રૂ.	3,310
સ્ટોક 1 એપ્રિલ 2023. રૂ.	1,500
મુખ્ય ઓફિસથી મળેલ માલ રૂ.	5,080
મુખ્ય ઓફિસને પરત કરેલ માલ રૂ.	70
કુલ વેચાણ રૂ.	9,350
ગ્રાહકોને કસર રૂ.	32
ગ્રાહકો પાસેથી પરત આવેલો માલ રૂ.	58
ગ્રાહકોને આપેલો વટાવ રૂ.	240
ધાલખાધ રૂ.	60
ગ્રાહકો પાસેથી મળેલ રોકડ રૂ.	4,920
ભાડુ કર વગેરે રૂ.	180
મજૂરી રૂ.	600
વેપારના સામાન્ય ખર્ચાઓ રૂ.	130
સ્ટોક 31 માર્ચ 2024 રૂ.	1,390

અથવા

પ્રશ્ન.૧ મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત પર 10% નફો ચડાવીને ભરતીયા કિંમતે માલ મોકલે છે. મુખ્ય ઓફિસના ચોપડે 2024ના વર્ષનું શાખા ખાતું નીચે મુજબ હતું તમારે શાખાનું વેપાર ખાતુ તથા નફા નુકસાન ખાતુ તૈયાર કરવાનું છે.

ઉ

શાખા ખાતું

જ

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
<u>બાકી આગળ લાવ્યા</u>		શરૂ. સ્ટોક તફાવત ખાતે	10,000
સ્ટોક. 1,10,000		શાખાએ પરત કરેલ માલ	11,000
પેટારોકડ 1,400		<u>રોકડ ખાતે</u>	
દેવાદારો. 1,40,000		રોકડ વેચાણ 7,05,000	
ફર્નિચર. 50,000	3,01,400	ઉધરાણી 3,83,000	
શાખાને મોકલેલ માલ	9,90,000	ધાલખાધ પરત 4,000	10,92,000
<u>બેંક ખાતે (ખર્ચા)</u>		માર્ગસ્થ માલ	33,000
ભાડુ રૂ. 17,000		શાખાને મોકલેલ માલ તફાવત	90,000
પગાર. 42,000		<u>બાકી આગળ લઈ ગયા</u>	
કરવેરા 10,000		સ્ટોક 2,20,000	
મજૂરી. 8,000		પેટા રોકડ 1,500	
જાહેરાત ખર્ચ 17,000	94,000	દેવાદારો 1,38,000	

માર્ગસ્થ માલ તફાવત ખાતે	3,000	ફર્નિચર	47,500	4,07,000
બેંક ખાતે (પેટા રોકડ)	1,100			
માલ પરત તફાવત ખાતે	1,000			
છેવટના સ્ટોક તફાવત ખાતે	20,000			
ચોખ્ખો નફો ન.નું ખાતે	2,32,500			
	16,43,000			16,43,000

અન્ય માહિતી

- (1) વર્ષ દરમિયાન શાખાના દેવાદારોએ માલ પરત કર્યો રૂ. 5,500.
- (2) શાખાના દેવાદારો ખાતે ઘાલખાધના રૂ. 1,000 માંડી વળ્યા અને દેવાદારોને રૂ. 2,000 વટાવ આપ્યો.
- (3) વર્ષ દરમિયાન શાખાના દેવાદારો ખાતે રૂ. 2,500 વ્યાજ ગણવામાં આવ્યું હતું.

પ્રશ્ન.૨ સૌરાષ્ટ્ર ઇલેક્ટ્રીક પાવર સપ્લાય કંપનીનું 31 માર્ચ 2024ના રોજનું કાર્યું સરવૈયું નીચે મુજબ હતું.

(૨૦)

વિગત	ઉધાર રૂ.	જમાં રૂ.
ઈક્વિટી શેર મૂડી દરેક રૂપિયા 10નો	--	18,00,000
10%ના ડિબેન્ચર	--	5,00,000
જામીનગીરી પ્રીમિયમ	--	1,95,000
10% ના રોકાણો	3,80,000	--
જમીન અને મકાન	6,00,000	--
યંત્રો	10,00,000	--
મેઈન્સ	5,00,000	--
ટ્રાન્સફોર્મર્સ	2,10,000	--
ફર્નિચર	1,10,000	--
સંગ્રાહકો (Accumulators)	40,000	--
દેવાદારો અને લેણદારો	2,80,000	2,90,000
જુના ભંગારનું વેચાણ	--	5,000
વીજળીનું વેચાણ	--	7,00,000
આકસ્મિક અનામત	--	1,60,000
સિન્કિંગ ફંડ અને સિન્કિંગ ફંડના રોકાણો	50,000	50,000
મીટર નું ભાડું	--	80,000
રોકાણોનું વ્યાજ	--	38,000
વહીવટી ખર્ચો	1,25,000	--
સ્થાપના ના ખર્ચ	30,000	--
સમારકામ અનામત	--	60,000
વીજળી ઉત્પાદન ખર્ચ	1,65,000	--
વીજળી વિતરણ ખર્ચ	40,000	--
ભાડુ અને વેરા	45,000	--
હાથ પર સ્ટોર્સ	1,40,000	--
કાનૂની ખર્ચો	10,000	--
ડિબેન્ચર્સનું વ્યાજ	25,000	--
હાથ પર રોકડ	2,05,000	--
વચગાળાનું ડિવિડન્ડ	95,000	--
સમારકામ ખર્ચ	10,000	--

શેર ફેર બદલી ફી	--	5,000
નફા નુકસાન ખાતુ (01-04-2023)	--	1,77,000
	40,60000	40,60,000

અન્ય માહિતી

(1) કંપની વર્ષ દરમિયાન નીચે મુજબ મૂડી ખર્ચ ચૂકવ્યો હતો

મેઈન્સ રૂ. 50,000 યંત્રો રૂ. 2,00,000
જમીન અને મકાન રૂ. 1,00,000 ફર્નિચર રૂ. 20,000

(2) કંપનીએ વર્ષ દરમિયાન 20,000 ઇક્વિટી શેર 10% પ્રીમિયમથી બહાર પાડ્યા છે.

(3) આકસ્મિક અનામત ખાતે રૂ. 50,000 લઈ જવાના છે.

(4) શરૂઆતની બાકી ઉપર નીચે મુજબ ઘસારો ગણવાનો છે.

મેઈન્સ 5%, યંત્રો અને ફર્નિચર 10%, જમીન અને મકાન 2%

(5) સિલિંગ ફંડ ખાતે રૂ. 10,000 લઈ જવાના છે.

2013 ના કંપની ધારાના પરિશિષ્ટ-3 મુજબ તૈયાર કરો.

(1) નફા નુકસાનનું પત્રક (2) પાકુ સરવૈયું

અથવા

પ્રશ્ન.૨ આદિત્ય ઇલેક્ટ્રીક કંપનીની તારીખ 31 માર્ચ 2024 ના રોજની નીચેની બાકીઓ આપવામાં આવી છે.

વિગત	રકમ રૂ.
6,000 ઇક્વિટી શેર દરેક ₹100 નો	6,00,000
5% ના ડિબેન્ચર.	5,00,000
યંત્રો.	3,50,000
જમીન અને મકાન	5,00,000
ટ્રાન્સફોર્મર્સ	15,000
મીટર્સ	50,000
મેઈન્સ	2,10,000
વીજળી ઉત્પાદન ખર્ચ	21,000
વીજળી વિતરણ ખર્ચ	13,500
વહીવટી ખર્ચ	36,500
સ્ટોર્સ નો સ્ટોક	24,000
મારામત અને નવીનીકરણનો ખરેખર ખર્ચ	7,500
મીટર દ્વારા વીજળીનું વેચાણ	2,54,000
કરાર દ્વારા વેચાણ	26,000
મીટર ભાડુ	10,000
મારામત અને નવીનીકરણ અનામત	30,000
દેવાદારો	28,000
લેણદાર	60,000
અન્ય ખર્ચાઓ	45,000
ચૂકવેલ ડિવિડન્ડ	24,000
નફા નુકસાન ખાતા ની જમા બાકી (1-4-2023)	1,10,000
30મી સપ્ટેમ્બર 2023 સુધીનું ચૂકવેલ ડિવિડન્ડ ઉપરનું વ્યાજ	12,500
ફર્નિચર	20,000
બેંક સિલક	18,000
તાર માટે થાંભલા	2,15,000

અન્ય વિગતો

(1) બધી જ મિલકતોની શરૂઆતની બાકી ઉપર 5% લેખે ઘસારા ની જોગવાઈ કરો.

(2) વર્ષ દરમિયાન કંપનીએ નીચે મુજબ મૂડી ખર્ચ કર્યા હતા:

મશીનરી રૂ.	30,000	મીટર્સ રૂ.	10,000
જમીન અને મકાન રૂ.	50,000	મેઇન્સ રૂ.	70,000

(3) દર વર્ષે મરામત અને નવીનીકરણ અનામત ખાતે રૂ. 23,000 લઈ જવામાં આવે છે.

(4) ચાલુ વર્ષે કરવેરા અંગેની જવાબદારીની રૂ. 50,000ની જોગવાઈ કરો.

ઉપરોક્ત વિગતો ધ્યાનમાં લઈ 2013ના કંપની ધારાની જોગવાઈઓ અનુસાર ઘી આદિત્ય ઈલેક્ટ્રીક કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરો.

પ્રશ્ન.3 જસ કં.લિ. નું 31 માર્ચ 2024 ના રોજ નું પાકું સરવૈયું નીચે મુજબ છે.

(૧૫)

જવાબદારીઓ	રકમ રૂ.	મિલકતો	રકમ રૂ.
સત્તાવાર શેર મૂડી	6,00,000	કાયમી મિલકતો	2,00,000
ભરાયેલ શેર મૂડી (40,000 શેર દરેક રૂ. 10 નો)	4,00,000	સ્ટોક	2,40,000
નફા નુકસાન ખાતુ	2,40,000	દેવાદારો	2,00,000
5% ના ડિબેન્ચર	2,60,000	બેંકમાં સિલક	4,00,000
લેણદારો	1,40,000		
	10,40,000		10,40,000

વાર્ષિક સભામાં નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું.

(1) 10% કરમુક્ત ડિવિડન્ડ રોકડેથી ચૂકવવું (કપાત નો દર 20%)

(2) દર જૂના ચાર શેરદીઠ એક શેર બોનસ તરીકે આપવો.

(3) બોનસ શેરની વહેંચણી પહેલા દર જૂના ચાર શેર ધરાવનાર હાલના શેરહોલ્ડરોને રૂ. 10 નો શેર રૂ. 15ના ભાવે ખરીદવાની તક આપવી. બધા શેરહોલ્ડરોએ આ શેર ખરીદ્યા

(4) ડિબેન્ચર 3% ના પ્રીમિયમે પરત કરવા.

જરૂરી આમનોંધ લખો અને પાકું સરવૈયું તૈયાર કરો.

અથવા

પ્રશ્ન.3 નીચે આપેલા વ્યવહારોની આમનોંધ લખો.

(1) એક કંપનીની સત્તાવાર મૂડી દરેક રૂપિયા 100 નો તેવા 10,000 શેરની બનેલી છે જેમાં કંપનીએ વધારો કરીને રૂ. 12,00,000 કરી.

(2) એક કંપનીએ દરેક રૂ. 100નો તેવા પૂર્ણ ભરપાઈ 8,000 ઇક્વિટી શેરનું નીચેની શરતોએ ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કરવાનું નક્કી કર્યું.

(A) દરેક શેરદીઠ રૂ. 110ની કિંમતે

(B) દરેક શેરદીઠ રૂ. 92ની કિંમતે.

(3) દરેક રૂ. 10નો તેવા 20,000 ઇક્વિટી શેરનું દરેક રૂ. 100નો તેવા 2,000 ઇક્વિટી શેરમાં એકત્રીકરણ કરવામાં આવ્યું.

(4) કંપનીની શેરમૂડી દરેક રૂ. 100નો તેવા 6,500 શેરની બનેલ છે. કંપનીએ આ શેરનું દરેક રૂ. 10નો તેવા ઇક્વિટી શેર અને દરેક રૂ. 10નો તેવા 10%ના પ્રેફરન્સ શેરમાં 6:4 પ્રમાણમાં વિભાગીકરણ કરવાનું નક્કી કર્યું.

(5) એક કંપની દરેક રૂ. 100નો તેવા 15,000 ઇક્વિટી શેરનું દરેક રૂ. 10નો તેવા 1,50,000 ઇક્વિટી શેરમાં વિભાગીકરણ કરવામાં આવ્યું.

પ્રશ્ન.4 એક વસ્તુ A, B અને C ત્રણ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને ત્યારબાદ તેને તૈયાર માલ સ્ટોક ખાતે ફેરવાય છે. (૧૫)

પ્રક્રિયા Aનું ઉત્પાદન ફેરબદલી કિંમત પર 25% નફા લેખે પ્રક્રિયા B ખાતે અને પ્રક્રિયા B તથા Cનું ઉત્પાદન દરેકની ફેરબદલી કિંમત પર 20% નફા લેખે ફેરવવામાં આવે છે.

તારીખ 31 માર્ચના રોજ નીચેની માહિતી મેળવવામાં આવી.

વિગત	પ્રક્રિયા-A	પ્રક્રિયા-B	પ્રક્રિયા-C	તૈયાર માલનો સ્ટોક રૂ.
શરૂઆતનો સ્ટોક	5,000	6,000	4,000	15,000
પ્રત્યક્ષ માલસામાન	10,000	10,500	15,000	--
પ્રત્યક્ષ મજૂરી	7,500	7,500	8,000	--
કારખાનાના પરોક્ષ ખર્ચ	7,000	3,000	20,000	--
આખર સ્ટોક	2,500	3,000	2,000	7,500
શરૂઆતના સ્ટોક માટે	--	1,000	1,000	5,500
આંતરપ્રક્રિયાનો નફો				

પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે આંકવામાં આવે છે. તૈયાર માલનો સ્ટોક પ્રક્રિયા C માંથી જે કિંમતે મેળવવામાં આવે છે તે કિંમતે આંકવામાં આવેલ છે. તૈયાર માલના વેચાણની રકમ રૂ.2,00,000 છે.

તમારે તૈયાર કરવાના છે.

(1) પ્રક્રિયા ખાતા અને તૈયાર માલના સ્ટોકનું ખાતું.

(2) ખરેખર મેળવેલ નફાનું પત્રક.

અથવા

પ્રશ્ન.૪ એક વસ્તુ તૈયાર કરતાં પહેલાં ત્રણ પ્રક્રિયામાંથી પસાર થાય છે. ભક્ત લિમિટેડના ચોપડામાંથી નીચે મુજબ માહિતી મળે છે.

વિગત	પ્રક્રિયા-1	પ્રક્રિયા-2	પ્રક્રિયા-3
માલસામાન	4,00,000	6,00,000	2,00,000
મજૂરી	6,00,000	4,00,000	8,00,000
આખર સ્ટોક	2,00,000	4,00,000	6,00,000

- તૈયાર માલનો આખર સ્ટોક રૂ. 4,00,000 હતો
- દરેક પ્રક્રિયાની પડતરને બીજી પ્રક્રિયા ખાતે ફેરબદલી કિંમત પર 20% નફો ચડાવીને બદલાવવામાં આવે છે. ત્રીજી પ્રક્રિયાની પડતર પણ તૈયાર માલના સ્ટોક ખાતે તે જ કિંમતે લઈ જવામાં આવે છે.
- દરેક પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે આંકવામાં આવે છે. તૈયાર માલનો સ્ટોક રૂ. 36,00,000 વેચવામાં આવે છે

તૈયાર કરો

(1) પ્રક્રિયા ખાતા અને તૈયાર માલ ના સ્ટોકનું ખાતું.

(2) ખરેખર મળેલ નફો દર્શાવતું પત્રક.

ENGLISH VERSION

Que.1 Khushi stores Ltd. Invoices goods to their various branches at cost and the branches sell on credit as well as for cash. From the following details related to the Junagadh branch so the you prepare branch trading account, profit and loss account and branch account in the books of head office. (20)

Debtors on 1 April 2023. Rs.	2,620
Debtors on 31 March 2024 Rs.	3,310
Stock on 1 April 2023. Rs.	1,500
Goods receive from head office Rs.	5,080
Goods return to head office. Rs.	70
Total sales Rs.	9,350
Allowances to debtors Rs.	32
Return from debtors Rs.	58
Discount allowed to debtors. Rs.	240
Bad debts Rs.	60
Cash received from debtors Rs.	4,920
Rent, Rates etc. Rs.	180
Wages Rs.	600
General Trade Charges Rs.	130
Stock 31 March 2024 Rs.	1,390

OR

Que.1 Head office sends goods at in invoice price by adding 10% on cost. Following is the Branch A/c for the year ending on 2024. Prepaid branch trading and profit and loss account

Dr		Branch Account.		Cr
Particular	Amount Rs.	Particular	Amount Rs.	
<u>Balance b/d</u>		Stock reserve (different in opening stock)	10,000	
Stock 1,10,000		Goods return by branch	11,000	
Petty cash 1,400		<u>Cash A/c</u>		
Debtors 1,40,000		Case sales 7,05,000		
Furniture 50,000	3,01,400	Cash received from debtor 3,83,000		
Good sent to branch A/c	9,90,000	Bad debt return 4,000	10,92,000	
<u>Bank A/c (Exp. Paid)</u>		Goods in transit	33,000	
Rent 17,000		Good sent to branch (diff.)	90,000	
Salary 42,000		<u>Balance C/f</u>		
Taxes 10,000		Stock 2,20,000		
Advertisement cost 17,000		Petty cash 1,500		
Labour 8,000	94,000	Debtors 1,38,000		
Goods in transit (Diff)	3,000	Furniture 47,500	4,07,000	
Bank A/c (petty cash)	1,100			
Goods return (diff.)	1,000			
Branch Stock reserve(differ) A/c	20,000			
Profit transfer to general profit and loss account	2,32,500			
	16,43,000		16,43,000	

- (1) During the year branch debtors have returned to branch goods of Rs. 5,500
- (2) Of the branch debtors Rs. 1,000 were written off as bad debts and discount allowed to debtors amounted Rs. 2,000
- (3) During the year the interest of Rs. 2,500 were charged to branch debtors A/c.

Que.2 The trial balance of Saurashtra electric power supply company limited as on 31st March 2024 was as under. (20)

Particulars	Debit Rs.	Credit Rs.
Equity share capital Rs 10 each	--	18,00,000
10% debenture	--	5,00,000
Securities Premium	--	1,95,000
10% investments	3,80,000	
Land and building	6,00,000	
Machineries	10,00,000	
Mains	5,00,000	
Transformers	2,10,000	
Furniture	1,10,000	
Accumulators	40,000	
Debtors and creditors	2,80,000	2,90,000
Sale of old scrap	--	5,000
Sales of electricity	--	7,00,000
Contingency reserve	--	1,60,000
Sinking fund and sinking fund investment	50,000	50,000
Meter rent	--	80,000
Interest on investment	--	38,000
Administrative expenses	1,25,000	--
Establishment expenses	30,000	--
Repair reserve	--	60,000
Generation cost of electric city	1,65,000	--
Distribution cost of electricity	40,000	--
Rent and rates	45,000	--
Stores on hand	1,40,000	--
Legal expenses	10,000	--
Interest on debenture	25,000	--
Cash on hand	2,05,000	--
Interim dividend	95,000	--
Repairs expenses	10,000	--
Share transfer fees	--	5,000
Profit and loss account (01-04-2023)	--	1,77,000
	40,60,000	40,60,000

Others formation

(1) company has spent following capital expenditure during the year

Mains. Rs.	50,000
Land in building Rs.	1,00,000
Machineries Rs.	2,00,000
Furniture Rs.	20,000

(2) Company has issues 20,000 equity share at 10% premium during the year.

(3) Transfer Rs.50,000 to contingency reserve.

(4) Depreciation provided on opening balance as follows.

Mains	5%
Machinery and furniture	10%
Land and building	2%

(5) Transfer Rs. 10,000 to sinking fund.

Prepare as per schedule-3 of the companies Act -2013.

(1) profit and loss statement

(2) balance sheet.

OR

Que.2 The following balance of Aditya electric company limited are given as on 31 March 2024.

Particulars	Amount Rs.
6,000 equity shares each of Rs.100	6,00,000
5% debenture.	5,00,000
Machinery	3,50,000
Land building	5,00,000
Transformers	15,000
Meters	50,000
Mains	2,10,000
Power production expenses	21,000
Power distribution expenses	13,500
Administrative expenses	36,500
Stock of stores	24,000
Actual expenses of repairs and renovates	7,500
Sale of electricity by meters	2,54,000
Sale by contracts	26,000
Meter rent	10,000
Repairs and renovates Reserve	30,000
Debtors	28,000
Creditors	60,000
Other expenses	45,000
Dividend paid	24,000
Profit and loss account credit (1-4-2023)	1,10,000
Interest paid on debenture up to 30 September, 2023	12,500
Furniture	20,000
Bank Balance	18,000
Wire Poles	2,15,000

(1) provide for depreciation at 5% on the opening balance of all assets.

(2) company has made following capital expenditure during the year:

Machinery Rs.	30,000	Meters Rs.	10,000
Land and building Rs.	50,000	Mains Rs.	70,000

(3) Rs. 23,000 is transferred to repairs and renovates reserve account every year.

(4) Provide Rs. 50,000 for liabilities of taxation of the current year.

(5) Prepaid final accounts as per the companies Act-2013.

Que.3 The balance sheet of jush co.Ltd. 31 March 2024 was as under.

(15)

Liabilities	Amount Rs.	Assets	Amount Rs
Authorised share capital	6,00,000	Fixed Assets	2,00,000
Paid up Share capital (40,000 share of Rs.10 each)	4,00,000	Stock	2,40,000
Profit and loss account	2,40,000	Debtors	2,00,000
5% debenture	2,60,000	Balance in Bank	4,00,000
Creditors	1,40,000		
	10,40,000		10,40,000

At the annual meeting it was agreed.

(1) To Pay a dividend in case of 10% free of tax (Rate of deduction of income tax is 20%).

(2) to issue one bonus share for every four old shares held.

- (3) to give existing shareholders the option to the purchase one share of Rs. 10 each at Rs.15 per share, for every four shares held prior to the bonus distribution. All the shareholder exercised their option.
- (4) To repay the debentures at a premium of 3%.
- Give the necessary journals entries and give the balance sheet after transaction are completed.

OR

Que.3 write Journal entries for the following transaction.

- (1) The authorised capital of company was 10,000 shares of Rs. 100 each and it was increased to Rs. 12,00,000.
- (2) A company decided to issue equity stock in the following manner in exchange of 8,000 equity shares of Rs 100 fully paid.
 - (A) At the rate of Rs. 110 for each share
 - (B) At the rate of Rs 92 for each share
- (3) 20,000 equity share of Rs. 10 each consolidated into 2,000 equity shares of Rs.100 each
- (4) The Share capital of company consists of 6,500 equity shares of Rs. 100 each. The company decided to sub-divide the same into equity shares of Rs. 10 each and 10% preference shares of Rs. 10 each in the ratio of 6:4.
- (5) 15,000 equity share of Rs. 100 each sub-divided into 1,50,000 equity shars of Rs. 10 each.

Que.4 A product passes through out three process A, B and C and thereafter it is transferred to finished stock account. Output of process A is transferred to process B at 25% profit on the transfer price and output of process B and process C each is transferred at 20% profit on each transfer price. (15)

The following information is received in respect of the year ended on 31st March.

Particulars	Process A	Process B	Process C	Finished stock Rs.
Opening stock	5,000	6,000	4,000	15,000
Direct materials	10,000	10,500	15,000	--
Direct labour	7,500	7,500	8,000	--
Factory overheads	7,000	3,000	20,000	--
Closing stock	2,500	3,000	2,000	7,500
Inter process profit including in opening stock	--	1,000	1,000	5,500

Stocks in process are valued at prime cost. Finished stock is valued at the price at which it is received from process C. Sales of finished stock is Rs. 2,00,000. You have to prepare

- (1) process accounts and finished stock account.
- (2) statement showing actual profit.

OR

Que.4 A product of bhakt Ltd. passes through three process following details are available.

Particulars	Process-1	Process-2	Process-3
Material	4,00,000	6,00,000	2,00,000
Labour	6,00,000	4,00,000	8,00,000
Closing stock	2,00,000	4,00,000	6,00,000

- Clothing stock of finished goods was Rs 4,00,000
- In every process, output is transferred at 20% profit on transfer price. Cost of process-3 is transferred to finished goods a/c on similar basis
- Stock of each process is valued at prime cost. Sale of finished goods during this period is Rs. 36,00,000

Prepare:

- (1) Process account and finish goods stock account
- (2) statement showing actual profit.
